

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૨/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૩૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૩ કેસ કરી, ૮ વ્યક્તિઓને ઝડપી, ૩૬ લીટર દેશી દારૂ, ૧૮૪ ઈંગ્લીશ દારૂ અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૧ વ્યક્તિને ઝડપી રોકડ રૂપિયા ૧૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૩૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૩૩૮/૧૮

સરખેજ: નીલેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ(ઉ.વ.૪૧) (રહે. આરોહી કેસ્ટ સોબો સેન્ટર મોલ સાઉથ બોપલ) એ તા.૧૭/૨/૧૮ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૦૮/૨૦૧૭ થી તા.૧૩/૮/૨૦૧૭ સુધીના સમયગાળા દરમિયાન આરોપી જયેશકુમાર ઉર્ફે રૂઢ્ર નરોતમભાઈ રાહોડ (રહે.બળીયાનગર અમરાઈવાડી) એ મકરબા દેવ પ્રાઈમ વોડાફોન હાઉસની પાસે ડુડલ એન્ડ હબ નામની ઓફીસ ખાતેથી ગણેશસેવા ટ્રસ્ટના મંત્રી હોવાનું તથા યુનીક એન્ટરપ્રાઈઝના પોતે વેપારી હોવાની ઓળખાણ આપી કુલ સાડીઓ નંગ-૬૦૦૦ કિંમત રૂપિયા ૧૩,૨૩,૦૦૦/- ખરીદી કરી નાણા નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.ડી.પંચાલ ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૩૩૯/૧૮

નારોલ: ગંગાચરણ કૈલાશ પ્રજાપતી (ઉ.વ.૨૮) (રહે.સુપર જયેશ સ્ટાઇલ લીકંપનીની રૂમમા ચંડોળા તળાવથી ત્રણ રસ્તા મસ્જીદથી આગળ દાણીલીમડા) તા.૧૭/૦૨/૨૦૧૮ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે નારોલ સર્કલ ચા ની કિટલી નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક રિક્ષામાં ત્રણ પુરૂષો આવ્યા હતા તે પૈકી પાછળ બેઠેલ બે પુરૂષોએ ગંગાચરણ પ્રજાપતીને છરી બતાવી રિક્ષામાં બેસાડી રોકડ રૂપિયા ૪૫૦૦/- અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦/- બળજબરીથી કાઢી લઈ માર મારી, કાશીરામ ફેક્ટરી આગળ ચાલુ રિક્ષામાંથી ગંગાચરણને ધક્કે મારી ઉતારી રિક્ષા લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ગંગાચરણ પ્રજાપતીએ નારોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.એસ પરમાર ચલાવે છે.

દાણીલીમડા: રમેશભાઈ હરીભાઈ ચૌહાણ (રહે. ચામુંડા સેલ પેટ્રોલપંપની સામે ભાટી કંપાઉન્ડ દાણીલીમડા) એ તા.૧૫/૦૨/૧૮ સાંજના ૭/૩૦ વાગે જય શ્રી ચામુંડા નગરની નજીક સેલ પેટ્રોલ પંપની સામે પોતાની બોલેરો પીકઅપ ગાડી નંબર ૨૭ વી ૨૫૮૬ કિમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૧૬/૨/૧૮ સવારના ૮/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ રમેશભાઈ ચૌહાણે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.જે.ખાંટ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:

મેઘાણીનગર: નિતેશ ઉર્ફે દિપક રમેશભાઈ તનપાલ (ઉ.વ.૨૪) (રહે.રૂપસીંગની ચાલી લક્ષ્મીનગર સોસાયટી પાસે મેઘાણીનગર) તા.૧૭/૦૨/૧૮ કલાક ૯/૩૦ વાગ્યાના સુમારે મેઘાણીનગર કાર્ગો ગેટની અંદર ઇલેક્ટ્રોનિક વોલ નં.૪૮ નજીકથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે.૧૮ યુ.૬૪૦૦ ના ચાલકે ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવી એક્ટીવાને ટક્કર મારતા નિતેશ ઉર્ફે દિપકને ગંભીર ઈજાઓ થતા સ્થળ ઉપર મૃત્યુનિપજ્યું હતું આ અંગેની ફરીયાદ મૃત્યુ પામનાર નિતેશના મિત્ર વિશાલે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.જી.રાવલજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.